

## ૬.૩ જીવનને અજવાળતા એકવીસ ગુણો

વર્તમાન વિશ્વની અનેક શોધખોળોથી કહેવાતી ભૌતિક સિદ્ધિકાળોની હારમાળા સર્જી દીધી છે. ચકાચોંધ કરી મુકે તેવી ઝાકામાળમાં માનવી અંજાઈ ગયો છે. બહારથી અપટુકેટ દેખાતા ભૌદ્ધિક માનવીનું જીવન અંદરથી અપ-સેટ સર્જાયેલું થતું જાય છે. આજની કરુણતા એ છે કે માનવીને ઉંઘવા માટે ગોળી લેવી પડે છે. ભૂખ માટે ગોળી લેવી પડે છે. વિકાર-વાસના સંતોષવા ગોળી લેવી પડે છે. બધી જ બાબતો માટે બીજા ઉપર નિર્ભર રહેવું પડે છે. પરંતુ વિજ્ઞાને હજુ એવી શોધ નથી કરી કે આખું ને આખું હૃદય બદલી નાંખતા માનવીના હૃદયના ભાવોને બદલી નાંખે. પૈસાથી કપડા મળે છે. દારેણાં મળે છે. રોટી, કપડા, મકાન બધું જ મળે છે પણ પૈસાથી અંતરમાં શાંતિ, સંતોષ, સુખ કે દુઅા વગેરે મળતું નથી.

જીવનના વાસ્તવિક સુખનો જો કોઈ પણ આધાર હોય તો તે સદગુણો છે. અને તેમાં પણ પાયાના સદગુણો જીવન જીવવા માટે રોટી, કપડા, મકાન જેટલા જ જરૂરી છે અને તે માટે આપણા પરમકાર્યાંના ભગવંતોએ શ્રાદ્ધવિધિ અને જૈનગ્રંથોમાં શ્રાવકના એકવીસ ગુણોની નોંધ આપી છે.

### શ્રાવકના એકવીસ ગુણો

- ૧) અદ્યુક્તઃ:- શ્રાવક કચારેય તુચ્છ હૃદયવાળો ન હોય, સ્વાર્થી ન હોય પરંતુ સ્વપરને ઉપકાર કરવાવાળો દિલાવર હોય છે. જેવાની સાથે તેવા થવાની વાત આ ગુણવાળાને શોભતી નથી. બીજાનું ભલું કરવામાં જ આપણું ભલું થતું હોય છે.
- ૨) ઝૂપવાનઃ:- સંપૂર્ણ પાંચેય ઈન્જિન્યુરોથી સુંદર દેખાતા સારા બાંધાવાળો હોય છે, સ્વભાવ જેનો સુંદર હોય છે, તે પણ ઝૂપવાન જ ગાણાય છે.
- ૩) શાંત પ્રકૃતિઃ:- બહારની હાય-વોય, દોડધામ અને અફડા-તફડી એના સ્વભાવમાં કચારેય હોતી નથી. સ્વભાવથી જ શાંત હોય છે અને સ્વભાવ વિરુદ્ધ અને લોકવિરુદ્ધ પાપપ્રવૃત્તિઓમાં એ કચારેય પ્રવૃત્તિ કરતો હોતો નથી.
- ૪) લોકપ્રિયઃ:- લોકોમાં જે પ્રિય હોય, લોકકલ્યાણાના કાર્યોથી જે પ્રિય હોય, દાન આપનાર હોય, સદાચારી, વિનયી અને મીઠું બોલનાર હોય તે લોકપ્રિય ગુણ કહ્યો છે.
- ૫) અકૂરઃ:- સ્વભાવથી જ તે દયાળુ હોય છે, કોઈને પણ પીડા, દુઃખ કે મુશ્કેલીઓ રહેલી હોય તે સહન કરી શકતો નથી. બીજાના દુઃખી થવામાં જ પોતાનું સુખ માનતો હોય છે. જે અનેકને શાંતિ અને શાંતા આપે છે.
- ૬) પાપભીરઃ:- પાપથી કરનારો, પાપથી ભાગનારો અને પાપથી દુઃખી થનારો ગુણ એ પાપભીર કહેવાય છે. પોતાના દુઃખથી સામી વ્યક્તિના જીવમાં પણ તેવું જ દુઃખ થાય છે, તેમ માનીને તે દુઃખના કારણાભૂત સર્વ પાપોને દૂરથી જ ત્વાગ કરનારો બને છે.

- ૭) અશાંકા:-** કોઈને પણ છેતરવાની વિદ્યા કે હોશીયારી તેના સ્વભાવમાં નથી હોતી, સરળતા એ તેનો સ્વભાવ હોય છે, તેનામાં લોકોને વિશ્વાસ બેસતો હોય છે દંભ, કપટ અને જૂઠથી તે યોજના દૂર રહેતો હોય છે.
- ૮) દાદ્ધિષ્યતાવાન:-** કોઈની પણ પ્રાર્થનાને છતી શક્તિએ તે ના પાડતો નથી, હંમેશા બીજાના સદ્ધભાવોને અવશ્ય પુરા કરવા માટે પ્રયત્ન કરે છે.
- ૯) લજાવાન:-** ક્યારેય અકાર્ય કરી શકે નાહિં, સદાચારમાં જ સહજ પ્રવૃત્તિ હોય છે અને સ્વીકારેલી વાતને તે છોડતો નથી.
- ૧૦) દયાવાન:-** સર્વજીવો ઉપર દયા રાખનારો હોય છે, દુઃખી જીવોના દુઃખને દૂર કરનારો હોય છે અને હંમેશા જીવો ઉપર કરુણાભૂષિદ્ધ રાખે છે.
- ૧૧) સૌમ્યાદિષ્ટવાન:-** વિપરીત વૃત્તિવાળા જીવોની કર્મની ગતિ જોઈને પણ દ્રેષ્ટ કરતા નથી, સર્વની સાથે સૌમ્યતાપૂર્વકનો વ્યવહાર રાખે છે.
- ૧૨) ગુણવાની:-** પોતાનાથી અધિક અને સમાન ગુણવાળા પ્રત્યે અંતરમાં સહજ લાગણીના ભાવો પ્રબળ બને છે તેઓનું આદર-બહુમાન જાળવતાં હોય છે અને ગુણવાનો પ્રત્યે અંતરમાં ક્યારેય દર્ખા, અસ્ત્રા, દોષો વગેરે હોતા નથી.
- ૧૩) સત્કથાખા:-** સંસારની પંચાતો, વિકથાઓને છોડીને ગુણકારી અને હિતકારી જ વાતો અને વાતાર્થો અના હૃદયમાં રમતી હોય છે અને કહેતા હોય છે.
- ૧૪) સુપક્ષાયકતા:-** જેમનો પરિવાર સદગુણોની બાબતે અને ધર્મની બાબતે અનુકૂળ હોય છે, સદાચારયુક્ત હોય છે અને સદ્વિચારોનું પોષણ થાય છે.
- ૧૫) દીર્ઘદશી:-** હંમેશા કોઈપણ કાર્યની શરૂઆત લાભાલાભનો વિચાર કરીને શરૂઆત કરતા હોય છે, હૃદયના ભાવો નિર્મળ બને તે રીતે જ નિર્ણય કરતા હોય છે અને પ્રશંસનીય કાર્યો પણ હિતકારી હોય તેવા જ કરતા હોયછે.
- ૧૬) વિશેષજ્ઞા:-** વિશેષરીતે કાર્યના, પ્રસંગાના પરિણામોને જે જાણે છે તે વિશેષજ્ઞ કહેવાય છે. જે પ્રવૃત્તિમાં ગુણ-દોષને ધર્મ-અધર્મને સારી રીતે સમજુને કરે છે.
- ૧૭) વૃદ્ધાનુગામી:-** જ્ઞાન વગેરે ગુણોથી જે ખૂબ આગામ વધેલા હોય તેની પદ્ધતિએ પોતાના જીવનની રીતિ-નીતિ અપનાવે તે અને પાપોના આચારમાં પ્રવર્ત્ત નાહિં તે વૃદ્ધાનુગામી છે.
- ૧૮) વિનયી:-** આપણાથી અધિકગુણવાળાની યોગ્ય રીતે સેવા, ભક્તિ, વિવેક કરે, તેને વિનયી કહેવાય છે. અકક્ષતા કે અહુમું જેમાં નથી તે.
- ૧૯) કૃતજ્ઞા:-** કરેલા ઉપકારોને ક્યારેય ભૂલે નાહિં અને ઉપકારીઓના ઉપકારનું અઝણ ચૂકવવા હંમેશા જે તત્પર રહે તેને કૃતજ્ઞ કરે છે.

**૨૦) પરહિતકારી:-** પોતાના સ્વાર્થ વગાર, બદલાની આશા વગાર અન્યનું, પાડોશીનું કે પારકાનું હિત કરનારો જે હોય તે પરહિતકારી કહેવાય છે.

**૨૧) લઘુલક્ષ્ય:-** જીવનના સઘળાએ કર્તવ્યોમાં, સઘળું ધર્મ કર્તવ્ય પોતે જાણી શકે અને યથાયોગ્ય આચારણ કરી શકે તેને લઘુલક્ષ્ય કહ્યો છે. જીવનના સઘળાએ સદગુણોની સફળતા આ ગુણને આભારી છે.

જીવનની અકળ આંટી દૂંટીઓ અને અગામ રહણ્યોનો પાર ભલે ન પામીએ, કહેવાતા અને અનુભવાતા દુઃખો દર્દોમાંથી ભલે કાયમી છૂટકારો આ ભવમાં ન મળે, કહેવાયેલા અનેક દોષો, અનેક ક્ષતિઓથી કયારે મુક્ત થઈ શકીએ તેની ભલે જાણ ન હોય પરંતુ સદગુણોના સ્વીકાર વગાર અને સ્વભાવની સુગંધ વગાર કયારેય આપણું જીવન ઉદ્ઘાતિના પંથે તો નથી જ ચાલવાનું તેની કરતાં બહેતર છે કે ફાની ભગવંતોના વચન ઉપર સંપૂર્ણ વિશ્વાસ મૂકી શક્ય પ્રયત્ને વધુને વધુ આપણે આપણા જીવનની સાર્થકતા માટે સદગુણોનું આલંબન લઈ, પ્રીતિ કેળવી અને તેને કેન્દ્રમાં રાખી ઉપરોક્ત સદગુણોને અપનાવી લઈએ.

jainuniversity.org